



સર્વોચ્ચ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત  
**જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર**  
 રૂમ નં-૧ ગ્રાઉન્ડ ફ્લોર, સી.બી. ભંડારી સ્કૂલ, વી.આર. મોલની સામે, મગદલ્લા,  
 સુરત ૩૯૪૫૧૮



Email : seniorcoach.surat@gmail.com

ક્રમાંક/ડી.એચ.સી.સી. ૫૫૬ - ૫૬૨ / ૨૦૨૨

તારીખ : ૨૧ / ૦૭ / ૨૦૨૨

પ્રતિ  
 આચાર્યશ્રી,  
 પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ તમામ,  
 સુરત શહેર

વિષય : ૬૧મી સુબ્રતો કપ અંતર્ગત ફૂટબોલ રમતની જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવા બાબત.  
 સંદર્ભ : ક્રમાંક:એસ.એ.જી./એસ.જી.એફ.આઈ/૨૦૨૨-૨૩/તા.૨૭/૦૭/૨૦૨૨ મુજબ.

જય ભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, ચાલુ વર્ષે સુબ્રતો કપ ઇન્ટરનેશનલ યોજનાર છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ફૂટબોલ રમતની સ્પર્ધાનું આયોજન-૨૦૨૨ કરવાનું હોય. આ સ્પર્ધાનો સમય અને વય જૂથની માહિતી નીચે મુજબ જણાવેલ છે, ઉપરોક્ત સ્પર્ધામાં વિજેતા ટીમ ને તા.૦૫/૦૮/૨૦૨૨ થી ૦૮/૦૮/૨૦૨૨ દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓએ ફરજિયાત પોતાની શાળાની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રિ-સુબ્રતો મુખર્જીની વેબસાઇટ પર કરાવેલ હોવું જોઈએ અને તેની વિગત અત્રેની કચેરી (જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરત, રૂમ નં-૧, સી.બી. ભંડારી સરસ્વતી સ્કુલ, મગદલ્લા, સુરત) ખાતે તા.૩૦-૦૭-૨૦૨૨નાં સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. સ્પર્ધા માટે શ્રી ઇલયાસ સીંગવાલાનો સંપર્ક કરવા વિનંતી. મો.નં. (૯૫૧૦૮ ૦૧૦૨૧)

ક્રમ	વય જૂથ	સ્પર્ધા તારીખ	સમય	સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદા	સ્પર્ધાનું સ્થળ
૧	અં-૧૪ ભાઈઓ	તા.૦૧-૦૮-૨૦૨૨	સવારે ૦૭:૦૦ કલાકે	તા.૦૧-૦૧-૨૦૦૯ પછી જન્મેલા	બોટાવાલા ગ્રાઉન્ડ, મોરાભાગળ, રાંદેર, સુરત
૨	અં-૧૭ બહેનો	તા.૦૧-૦૮-૨૦૨૨	સવારે ૦૭:૦૦ કલાકે	તા.૦૧-૦૧-૨૦૦૬ પછી જન્મેલા	
૩	અં-૧૭ ભાઈઓ	તા.૦૨-૦૮-૨૦૨૨	સવારે ૦૭:૦૦ કલાકે	તા.૦૧-૦૧-૨૦૦૬ પછી જન્મેલા	




અગત્યની સૂચનાઓ :

- ૧) આ સ્પર્ધામાં ફક્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં એક જ શાળાના વિદ્યાર્થીની ટીમનું પ્રવેશપત્ર મોકલવાનું રહેશે. વિજેતા થનાર આખી ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા મોકલવામાં આવશે.
- ૨) સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓના નામ, જન્મ તારીખ અને જી.આર.નં. શાળાના લેટર પેડ પર આચાર્યશ્રીના સહી સિક્કા કરી તેની યાદી લઈને આવવાની રહેશે.
- ૩) સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે લાવાની રહેશે તથા શાળાનો આઈ કાર્ડ સાથે રાખવાનો રહેશે.

વધુ માહિતી માટે (શાહનવાઝ શેખ)નો સંપર્ક કરવો

મો.નં -(૮૧૪૧૨ ૨૨૫૦૨)

  
જિલ્લા રમત વિકાસ અધિકારી  
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,  
સુરત.

નકલ સવિનય રવાના :-

- ૧) કલેક્ટરશ્રી સુરત.
- ૨) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સુરત
- ૩) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સુરત
- ૪) જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, સુરત-શહેર
- ૫) પ્રમુખ/મંત્રીશ્રી, વ્યાયમ શિક્ષકસંઘ સુરત-શહેર
- ૬) પ્રમુખ/મંત્રીશ્રી, સુરત જિલ્લા ફુટબોલ એસોસીએશન, સુરત